

Seat No.: \_\_\_\_\_

Enrolment No. \_\_\_\_\_

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
DIPLOMA ENGINEERING – SEMESTER – 1 - EXAMINATION – SUMMER-2022

**Subject Code: 4300001**

**Date :24-08-2022**

**Subject Name: Mathematics**

**Time:02:30 PM TO 05:00 PM**

**Total Marks:70**

**Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.

Q.1 Fill in the blanks using appropriate choice from the given options: 14  
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો

(1)  $\begin{vmatrix} 5 & 7 \\ -3 & -2 \end{vmatrix} = \underline{\hspace{2cm}}$   
(a) 11 (b) -11 (c) 31 (d) -31

(2) If  $f(x) = x^3 - 1$  then, the value of  $f(2) - f(3) = \underline{\hspace{2cm}}$   
જો  $f(x) = x^3 - 1$  હોય તો,  $f(2) - f(3)$  નું મૂલ્ય = \_\_\_\_\_  
(a) 19 (b) -19 (c) 35 (d) -35

(3)  $\frac{1}{\log_2 6} + \frac{1}{\log_3 6} = \underline{\hspace{2cm}}$   
(a) 6 (b) 2 (c) 1 (d) 5

(4) If  $f(x) = \log_e e^x$  then,  $f(-1) = \underline{\hspace{2cm}}$   
જો  $f(x) = \log_e e^x$  હોય તો,  $f(-1) = \underline{\hspace{2cm}}$   
(a) -1 (b) 1 (c) 0 (d) e

(5)  $12^0 = \underline{\hspace{2cm}}$  radian  
 $12^0 = \underline{\hspace{2cm}}$  રેડિયન  
(a)  $\frac{\pi}{15}$  (b)  $15\pi$  (c)  $3\pi$  (d)  $\frac{2\pi}{3}$

(6) Principal period of  $f(x) = \sin(3 - 5x)$  is \_\_\_\_\_  
 $f(x) = \sin(3 - 5x)$  નું મુખ્ય આવર્તમાન \_\_\_\_\_ છે.

(a)  $\frac{5\pi}{2}$                       (b)  $\frac{2\pi}{5}$                       (c)  $\frac{-5\pi}{2}$                       (d)  $\frac{2\pi}{3}$

(7)  $3\tan^{-1}(\sqrt{3}) = \underline{\hspace{2cm}}$

(a)  $120^0$                       (b)  $60^0$                       (c)  $180^0$                       (d)  $30^0$

(8)  $(i + 2k) \cdot (3j + k) = \underline{\hspace{2cm}}$

(a) 7                      (b) 3                      (c) 1                      (d) 2

(9)  $k \times i = \underline{\hspace{2cm}}$

(a) j                      (b) -j                      (c) 1                      (d) 0

(10) Slope of the straight line  $\frac{x}{2} - \frac{y}{3} = 1$  is  $\underline{\hspace{2cm}}$

ସ୍ତରેખ  $\frac{x}{2} - \frac{y}{3} = 1$  ની ઢાલ  $\underline{\hspace{2cm}}$  છે

(a)  $\frac{2}{3}$                       (b)  $\frac{3}{2}$                       (c)  $-\frac{2}{3}$                       (d)  $-\frac{3}{2}$

(11) Radius of the circle  $x^2 + y^2 - 2x + 4y + 1 = 0$  is  $\underline{\hspace{2cm}}$

વર્તુળ  $x^2 + y^2 - 2x + 4y + 1 = 0$  ની ત્રિજ્યા  $\underline{\hspace{2cm}}$  છે.

(a) 2                      (b)  $\sqrt{2}$                       (c) 6                      (d)  $\sqrt{6}$

(12)  $\lim_{x \rightarrow 0} \frac{\sin x}{x} = \underline{\hspace{2cm}}$

(a)  $\frac{\pi}{180}$                       (b)  $\frac{180}{\pi}$                       (c) 1                      (d) 0

(13)  $\lim_{x \rightarrow a} \frac{x^2 - a^2}{x - a} = \underline{\hspace{2cm}}$

(a) 2                      (b) 0                      (c)  $2a^2$                       (d) 2a

(14)  $\lim_{x \rightarrow 2} \frac{x^2 - 2}{x^3 - 4} = \underline{\hspace{2cm}}$

(a) 2                      (b)  $\frac{1}{2}$                       (c)  $\frac{-1}{2}$                       (d) -2

Q.2 (A) Attempt any two:

ગમે તે બે ગણો:

(1) Solve:  $\begin{vmatrix} x-2 & 2 & 2 \\ -1 & x & -2 \\ 2 & 0 & 4 \end{vmatrix} = 0$

ઉકેલ શોધો:  $\begin{vmatrix} x-2 & 2 & 2 \\ -1 & x & -2 \\ 2 & 0 & 4 \end{vmatrix} = 0$

(2) If  $f(x) = \frac{\sqrt{9-x}}{\sqrt{9-x}+\sqrt{x}}$  then Prove that  $f(x) + f(9-x) = 1$

જો  $f(x) = \frac{\sqrt{9-x}}{\sqrt{9-x}+\sqrt{x}}$  હોય તો, સાબિત કરો કે  $f(x) + f(9-x) = 1$

(3) Evaluate:  $3\sin^2 \frac{\pi}{3} - \frac{3}{4} \tan^2 \frac{\pi}{6} + \frac{4}{3} \cot^2 \frac{\pi}{6} - 2\operatorname{cosec}^2 \frac{\pi}{3}$ :

કિંમત શોધો :  $3\sin^2 \frac{\pi}{3} - \frac{3}{4} \tan^2 \frac{\pi}{6} + \frac{4}{3} \cot^2 \frac{\pi}{6} - 2\operatorname{cosec}^2 \frac{\pi}{3}$

(B) Attempt any two:

08

ગમે તે બે ગણો:

(1) If  $f(x) = \frac{1-x}{1+x}$  then Prove that

જો  $f(x) = \frac{1-x}{1+x}$  હોય તો, સાબિત કરો કે

(i)  $f(x) \cdot f(-x) = 1$  and (ii)  $f(x) + f\left(\frac{1}{x}\right) = 0$

(2) If  $\log\left(\frac{a+b}{2}\right) = \frac{1}{2} \log a + \frac{1}{2} \log b$  then Prove that  $a = b$

જો  $\log\left(\frac{a+b}{2}\right) = \frac{1}{2} \log a + \frac{1}{2} \log b$  હોય તો, સાબિત કરો કે  $a = b$

(3) Prove that:  $\frac{1}{\log_{xy}(xyz)} + \frac{1}{\log_{yz}(xyz)} + \frac{1}{\log_{zx}(xyz)} = 2$

સાબિત કરો કે:  $\frac{1}{\log_{xy}(xyz)} + \frac{1}{\log_{yz}(xyz)} + \frac{1}{\log_{zx}(xyz)} = 2$

Q.3 (A) Attempt any two:

06

ગમે તે બે ગણો:

(1) Prove that:  $\sin 780^\circ \sin 480^\circ + \cos 120^\circ \sin 30^\circ = \frac{1}{2}$

સાબિત કરો કે:  $\sin 780^\circ \sin 480^\circ + \cos 120^\circ \sin 30^\circ = \frac{1}{2}$

(2) Prove that:  $\tan 55^\circ = \frac{\cos 10^\circ + \sin 10^\circ}{\cos 10^\circ - \sin 10^\circ}$

સાબિત કરો કે:  $\tan 55^\circ = \frac{\cos 10^\circ + \sin 10^\circ}{\cos 10^\circ - \sin 10^\circ}$

(3) Find the equation of a circle with Centre  $(-3, -2)$  and area  $9\pi$  sq. unit.

વર્તુળનું સમીકરણ શોધો કે, જેનું કેન્દ્ર  $(-3, -2)$  અને ક્ષેત્રફળ  $9\pi$  ચો.એકમ છે.

(B) Attempt any two:

08

ગમે તે બે ગણો:

(1) Prove that:  $\frac{1+\sin\theta+\cos\theta}{1+\sin\theta-\cos\theta} = \cot\frac{\theta}{2}$

સાબિત કરો કે:  $\frac{1+\sin\theta+\cos\theta}{1+\sin\theta-\cos\theta} = \cot\frac{\theta}{2}$

(2) Draw the graph of  $y = \cos x$ ,  $0 \leq x \leq \pi$

આલેખ દોરો :  $y = \cos x$ ,  $0 \leq x \leq \pi$

(3) If  $\vec{a} = (3, -1, -4)$ ,  $\vec{b} = (-2, 4, -3)$  and  $\vec{c} = (-1, 2, -1)$  then Find the direction cosines of  $3\vec{a}-2\vec{b}+4\vec{c}$ .

જો  $\vec{a} = (3, -1, -4)$ ,  $\vec{b} = (-2, 4, -3)$  અને  $\vec{c} = (-1, 2, -1)$  હોય તો, સદિશ  $3\vec{a}-2\vec{b}+4\vec{c}$  ના દિગ્કોસાઈન શોધો.

Q.4 (A) Attempt any two:

06

ગમે તે બે ગણો:

(1) If the two vectors  $m\vec{i}+2m\vec{j}+4\vec{k}$  and  $m\vec{i}-3\vec{j}+2\vec{k}$  are perpendicular to each other then find m.

જો બે સદિશો  $m\vec{i}+2m\vec{j}+4\vec{k}$  અને  $m\vec{i}-3\vec{j}+2\vec{k}$  એકબીજાને લંબ હોય તો, m ની કિંમત શોધો.

(2) Find angle between the two vectors  $\vec{i}+2\vec{j}+3\vec{k}$  and  $-2\vec{i}+3\vec{j}+\vec{k}$

બે સદિશો  $\vec{i}+2\vec{j}+3\vec{k}$  અને  $-2\vec{i}+3\vec{j}+\vec{k}$  વચ્ચેનો ખૂણો શોધો.

(3) Find the equation of line passing through the point (4,3) and perpendicular to the line  $4y - 3x + 7 = 0$ .

બિંદુ (4,3)માંથી પસાર થતી અને રેખા  $4y - 3x + 7 = 0$  ને લંબ હોય તેવી સુરેખાનું સમીકરણ શોધો.

(B) Attempt any two:

08

ગમે તે બે ગણો:

(1) Find unit vector perpendicular to both vectors  $\vec{a} = (3, 1, 2)$  and  $\vec{b} = (2, -2, 4)$

સદિશો  $\vec{a} = (3, 1, 2)$  અને  $\vec{b} = (2, -2, 4)$  બંને ને લંબ હોય તેવા સદિશનો એકમ સદિશ શોધો.

(2) Under the effect of forces  $\vec{i} + \vec{j} - 2\vec{k}$  and  $2\vec{i} + 2\vec{j} - 4\vec{k}$ , an Object is displaced from  $\vec{i} - \vec{j}$  to  $3\vec{i} + \vec{k}$ . Find the work done.

બળો  $\vec{i} + \vec{j} - 2\vec{k}$  અને  $2\vec{i} + 2\vec{j} - 4\vec{k}$  ની અસર હેઠળ એક પદાર્થનું  $\vec{i} - \vec{j}$  થી  $3\vec{i} + \vec{k}$  સુધી સ્થાનાંતર થાય છે, તો થયેલ કાર્ય શોધો.

(3) Find:  $\lim_{x \rightarrow 2} \frac{x^3 - x^2 - 5x + 6}{x^2 - 5x + 6}$

શોધો:  $\lim_{x \rightarrow 2} \frac{x^3 - x^2 - 5x + 6}{x^2 - 5x + 6}$

Q.5 (A) Attempt any two:

06

ગમે તે બે ગણો:

(1) Find:  $\lim_{x \rightarrow 2} \left( \frac{1}{x-2} - \frac{2}{x^2-2x} \right)$   
 શોધો:  $\lim_{x \rightarrow 2} \left( \frac{1}{x-2} - \frac{2}{x^2-2x} \right)$

(2) Find:  $\lim_{x \rightarrow \infty} \left( 1 + \frac{5}{x} \right)^{\frac{2x}{3}}$   
 શોધો:  $\lim_{x \rightarrow \infty} \left( 1 + \frac{5}{x} \right)^{\frac{2x}{3}}$

(3) Find:  $\lim_{x \rightarrow 0} \frac{e^x + \sin x - 1}{x}$   
 શોધો:  $\lim_{x \rightarrow 0} \frac{e^x + \sin x - 1}{x}$

(B) Attempt any two:  
 ગમે તે બે ગણો:

08

(1) If two lines  $kx + (2-k)y + 3 = 0$  and  $2x + (k+1)y - 5 = 0$  are parallel to each other then find the value of  $k$ .  
 બે રેખાઓ  $kx + (2-k)y + 3 = 0$  અને  $2x + (k+1)y - 5 = 0$  એકબીજાને સમાંતર હોય તો  $k$  ની કિંમત શોધો.

(2) If the measure of the angle between two lines is  $\frac{\pi}{4}$  and the slope of one of line is  $\frac{3}{2}$  then, find the slope of the other line.  
 જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ  $\frac{\pi}{4}$  હોય તથા તેમાંની ની એક રેખાનો ઢાળ  $\frac{3}{2}$  હોય તો બીજી રેખાનો ઢાળ શોધો.

(3) Find equation of tangent to the circle  $2x^2 + 2y^2 + 3x - 4y + 1 = 0$  at the point  $(-1, 2)$   
 વર્તુળ  $2x^2 + 2y^2 + 3x - 4y + 1 = 0$  પરના બિંદુ  $(-1, 2)$  એ તેના સ્પર્શકનું સમીકરણ શોધો.

\*\*\*\*\* Best Wishes \*\*\*\*\*